



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૧૩/૦૮/૨૦૧૯ મંગળવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૫૯/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૩ કેસ કરી, ૩૬ વ્યક્તિઓને ઝડપી, ૧૭૧ લીટર દેશી દારૂ અને ૨૩ બોટલ ઈંગ્લીશ દારૂ કબજે કર્યો હતો. તેમજ જુગારધારા હેઠળ ૬ કેસ કરી, ૧૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૪૩,૪૪૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૩૬૦/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૩૦ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.હી.૯૩ મુજબ ૧ વ્યક્તિની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ધરફોડ:-

સમાચાર યાદી નં.૧૩૬૧/૧૯

વસ્ત્રાપુર: અમિતાબહેન વા/ઓફ નવીનભાઈ લોફિસ (રહે. સફલ પરિસર-૨ સાઉથ બોપલ) એ તા.૧૨/૦૮/૧૯ નારોજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૦૮/૦૮/૧૯ કલાક ૧૦/૦૦ થી તા.૧૧/૦૮/૧૯ કલાક ૧૦/૩૦ વાગ્યા દરમિયાન તીર્થધામ અદાણી ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર ૨૦૭ માંથી સોનાના દાગીના કિંમત રૂપિયા ૨,૩૦,૦૦૦/- સાથેનું પર્સ અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એન.આર.ભરવાડ ચલાવે છે.

મેઘાણીનગર: ચંદ્રવદન પુરષોત્તમદાસ પટેલ (રહે. કેશવબાગ સોસાયટી રત્નાસાગર ચાર રસ્તા પાસે મેઘાણીનગર) એ મેઘાણીનગર પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૮/૧૯ કલાક ૦૦/૦૦ થી સવારના ૬/૦૦ વાગ્યા દરમિયાન પોતાના મકાનના દરવાજાનું તાળુ તોડી અજાણી વ્યક્તિ ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૬૦,૦૦૦/ અને રોકડ રૂપિયા ૧૪,૦૦૦/ મળી કુલ રૂપિયા ૭૪,૦૦૦/ મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.ડી.જાડેજા ચલાવે છે.

ચોરી:-

સમાચાર યાદી નં.૧૩૬૨/૧૯

ચાંદખેડા: ખુશ્બુબહેન વા/ઓ શાલીનભાઈ દેસાઈ (રહે. જે-૦૯ એપાર્ટમેન્ટ આર્યમાન બંગ્લોઝની બાજુમા થલતેજ) એ તા.૧૧/૦૮/૧૯ રાતના ૮/૪૫ થી ૧૦/૩૦ વાગ્યા દરમિયાન ચાંદખેડા વિસત ગાંધીનગર હાઇવે ઉપર આવેલ આમ્રકુંજ એવીસ કોમ્પ્લેક્ષ બહાર પાર્ક કરેલ પોતાની કારના દરવાજાનો કાચ તોડી કારમાંથી પર્સ, સોનાની વીંટી કિંમત રૂપિયા ૧૦,૦૦૦/-, ચાંદીનો સીક્કો કિંમત રૂપિયા ૪૦૦/-, મોબાઈલ ફોન કિંમત રૂપિયા ૮૦૦૦/- અને રોકડ રૂપિયા ૨૫,૦૦૦/- તેમજ સાહેદ રચીતભાઈ બી ભાવસાર ની કારના દરવાજાનો કાચ તોડી કારમાંથી લીનોવો કંપનીનું લેપટોપ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૬૮,૪૦૦/- અજાણી વ્યક્તિ ચોરી કરી લઈ ગઈ છે. આ અંગેની ફરીયાદ ખુશ્બુબહેન દેસાઈએ ચાંદખેડા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જી.વી.ચૌધરી ચલાવે છે.

સોલા હાઈકોર્ટ: પ્રવિણભાઈ સ/ઓ આત્મારામભાઈ પટેલ (ઉ.વ.૬૭) (રહે.ભાર્વી ટાવર શારદા સ્કુલ સામે સીટીએમ અમરાઈવાડી) એ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૨/૦૮/૧૯ સવારના ૧૧/૦૦ વાગ્યાના સુમારે થલતેજ આંનદ કોમ્પ્લેક્ષ જય ગાયત્રી ટ્રેડીંગ નામની પોતાની દુકાન આગળ દુકાનમાંથી સામાન કઢાવવાનું કહી અજાણ્યો પુરૂષ સામાન કાઢતો હતો તે સમયગાળા દરમ્યાન નજર ચુકવી પ્રવિણભાઈની દુકાનના ટેબલના ખુલ્લા ડ્રોવરમાંથી રોકડ રૂપિયા ૪૦,૦૦૦/- ચોરી કરી લઈ ગયો છે. આ ગુનાની તપાસ હે.કો.શ્રી સિંકદર જસુભા ચલાવે છે.

દાઝી જતા મૃત્યુ:-

સમાચાર યાદી નં.૧૩૬૩/૧૯

દાણીલીમડા: મુનિહલ સ/ઓ હિમાયત શેખ (ઉ.વ.૩૦) (રહે. સીમ્મા મસ્જીદ પાસે મેહમુદ કિરાણા સ્ટોરની બાજુમા નવાબનગર શાહઆલમ) તા.૦૩/૦૮/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે દાણીલીમડા ગુલાબનગર સુએઝ ફાર્મ ખાતે આવેલ કચરાના ઢગલામાં કચરો વિણતા હતા દરમિયાન અચાનક કચરામા આગ લાગતા દાઝી ગયા હતા. સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૨/૦૮/૧૯ કલાક ૬/૩૦ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે દાણીલીમડા પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ મ.સ.ઈ.શ્રી પ્રધાનજી ખેંગારજી ચલાવે છે.

આત્મહત્યા :-

સમાચાર યાદી નં.૧૩૬૪/૧૯

કૃષ્ણનગર: નિકુંજ સ/ઓ સંજયભાઈ કણજારીયા (ઉ.વ.૨૦) (રહે. વાસુદેવ પાર્ક કર્ણાવતી સોસાયટી સામે બાપાસીતારામ ચોકની બાજુમા નવા નરોડા) એ અગમ્ય કારણસર તા.૧૨/૦૮/૧૯ બપોરના ૧૨/૪૫ વાગ્યાના સુમારે પોતાના ઘરે પંખાના હુકમાં રૂમાલ બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી વિજયકુમાર મારુતીરાવ ચલાવે છે.

નિકોલ: જ્યોત્સનાબહેન વિજયભાઈ ઠાકોર (ઉ.વ.૧૯) (રહે. ભુવાલડી ગામ હોળી ચકલા દશકોઈ અમદાવાદ) એ અગમ્ય કારણસર તા.૧૧/૦૮/૧૯ બપોરના ૧૨/૩૦ વાગ્યાના સુમારે પોતાના ઘરે પોતાની જાતે પોતાના શરીર ઉપર કેરોસીન છાટી સળગી જતા સીંગરવા સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તા.૧૨/૦૮/૧૯ કલાક ૧/૪૫ વાગે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ પો.સ.ઈ.શ્રી આર.આઇ.મનસુરી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.